

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૧૧/૨૦૧૬ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી અને જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૬૫/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી ૧૭૩ લીટર દેશી દારૂ, ૧૧ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૨ ફ્લોટર ઇંગ્લીશ દારૂ, ૧૪૪ બીયરટીન કબ્જે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૦,૫૦૦/- અને જુગારનાં સાધનો કબ્જે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૬૬/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ખુનની કોશીશની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૦૬૭/૧૬

વાડજ : પાર્વતીબેન ડો/ઓ મગનભાઈ સોલંકી (ઉ.વ.૨૦) (રહે. સૌરાષ્ટ્ર શ્રમજીવીનગરના છાપરા જુનાવાડજ) એ સિવિલ હોસ્પિટલ ખાતે વાડજ પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૧૧/૧૬ સવારના ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક આરોપી તુષાર ઉર્ફે કાળો (રહે.સૌરાષ્ટ્ર શ્રમજીવીનગરના છાપરા જુનાવાડજ) એ પાર્વતીબેનને અવાર-નવાર રસ્તામાં રોકી, લગ્ન કરવાની ધાક-ધમકી આપતાં, પાર્વતીબેને ના પાડતાં બોલાચાલી ઝઘડો થયેલ. જેની અદાવત રાખી આરોપી તુષાર અને તેનાં પાંચ સાગરીતોએ ભેગામળી પાર્વતીબેનનાં ભાઈ શૈલેષભાઈ મગનભાઈ સોલંકીને લાકડી, પાઈપો અને ઘોંકા વડે માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની કોશીશ કરી હતી. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી વી.જી.રાઠોડ ચલાવે છે.

બળાત્કારની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૨૦૬૮/૧૬

વટવા : વટવા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની પરણીતાએ તા.૮/૧૧/૧૬ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૫/૧૧/૧૬ સાંજનાં ૬/૧૫ વાગ્યાના સુમારે ઘર નજીક રહેતો આરોપી આબીદ ઉર્ફે અસલમ ઉર્ફે ગેંડો સ/ઓ રૂસ્તમભાઈ શેખ એ પરણીતાનાં ઘરે આવી છરી બતાવી, પરણીતાનાં પતિ અને બહેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી, પરણીતાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જે.એચ.સરવૈયા ચલાવે છે.

ઉપરોક્ત ગુનાનાં આરોપી આબીદ ઉર્ફે અસલમ ગેંડો સ/ઓ રૂસ્તમભાઈ હમીદભાઈ શેખ ને તા.૮/૧૧/૧૬ રાતનાં ૯/૦૦ વાગે પો.ઈ.શ્રી જે.એચ.સરવૈયા નાઓએ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

સોલા હાઇકોર્ટ : ચંદ્રકાંતભાઈ વલ્લભભાઈ શાહ (રહે,વૈભવ બંડ્લોઝ વિભાગ-૧ ભુયંગદેવ ઘાટલોડીયા) એ તા.૮/૧૧/૧૬ નારોજ સોલા હાઇકોર્ટ ખાતે ફરીયાદ નોંધાવી છે કે ઘાટલોડીયા ચાણ્ડ્યપુરી આર.સી.ટેકનીકલ રોડ એપોલો આર્કેડ ઓફીસ નં-૩૦૫ ખાતે આરોપી (૧) કેતનભાઈ અરવિંદભાઈ મોદી (૨) હેતલબેન કેતનકુમાર મોદી (બંને રહે, શાયોના પ્રસાદ બંડ્લોઝ ચાંદલોડીયા) અને (૩) કમલેશ દેવરામ પ્રજાપતી (રહે, અક્ષય એપાર્ટમેન્ટ, ચાણ્ડ્યપુરી ઘાટલોડીયા) નાઓએ ભેગા મળી ફેબ્રુઆરી ૨૦૧૫ થી આજદિન સુધીનાં સમયગાળા દરમ્યાન જીવન આધાર ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી, ચંદ્રકાંતભાઈને ખાખરાના ધંધા માટે પૈસા રોકાણ કરવાનું જણાવી, ચંદ્રકાંતભાઈ પાસેથી રૂપિયા ૭૧ લાખ મેળવી લઈ પરત નહી આપી તેમજ જીવન આધાર ફાઉન્ડેશનમાં એજન્ટો તથા સભ્યોની રકમ પરત નહી આપી, તમામ રકમ મેળવી લઈ, તમામ સાથે વિશ્વસઘાત અને છેતરપીંડી કરી પલાયન થઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી ડી.વી.રાણા ચલાવે છે.

આત્મહત્યા:-

બાપુનગર : મહેશભાઈ માનાભાઈ ચાવડા (ઉ.વ.૪૫) (રહે, વિરાભગતની ચાલી અન્નપુર્ણા સોસાયટીની બાજુમાં, બાપુનગર) નાંઓનાં લગ્ન થયેલ ના હોય અને એકલુ જીવન જીવતા હોય, એકલતાથી કંટાળી કે અન્ય કોઈ કારણસર તા.૮/૧૧/૧૬ ના કલાક ૪/૩૦ થી ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પોતાની જાત ઉપર કેરોસીન છાંટી, સળગી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ગોવિંદભાઈ જીવાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.